

Sl.No.

0100781

11(G)

(MARCH, 2019)

પ્રશ્ન પેપરનો સેટ નંબર જેની
સામેનું વર્તુળ OMR શીટમાં
ધૂંકરવાનું રહે છે.
Set No. of Question Paper,
circle against which is to be
darken in OMR sheet.

y
2

Part - A : Time : 1Hour / Marks : 50

Part - B : Time : 2 Hours / Marks : 50

01

(Part - A)

Time : 1 Hour]

[Maximum Marks : 50

સૂચનાઓ :

- 1) આ પ્રશ્નપત્રના ભાગ-A માં હેતુલક્ષી પ્રકારના 50 પ્રશ્નો છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
- 2) પ્રશ્નોની કમ સંખ્યા 1 થી 50 છે અને દરેક પ્રશ્નનો ગુણ 1 છે.
- 3) કાળજીપૂર્વક દરેક પ્રશ્નનો અભ્યાસ કરી સાચો વિકલ્પ પસંદ કરીને OMR શીટમાં જવાબ લખવો.
- 4) પ્રશ્નના જવાબ માટે OMR શીટ આપવામાં આવેલ છે. તેમાં જે તે પ્રશ્ન નંબર સામે (A) O, (B) O, (C) O, (D) O આપેલા છે. તે પ્રશ્નનો જ જવાબ સાચો હોય તેના વિકલ્પ પરના વર્તુળને બોલ-પેનથી પૂર્ણ ● ધૂંકરવાનું રહેશે.
- 5) રફ કાર્ય હેતુ આ ટેસ્ટ બુકલેટમાં જ આપેલી જબ્યા પર કરવાનું રહેશે.
- 6) પ્રશ્નપત્રકના ઉપરની જમણી બાજુમાં આપેલા પ્રશ્નપત્રક સેટ નં. ને OMR પત્રકમાં આપેલી જબ્યામાં લખવાનું રહેશે.

- 1) એક વૈજ્ઞાનિક કે જેમણે ભારપૂર્વક સૂચયું કે “જો કોઈ પદાર્થ કે સાધનની કાર્યક્ષમતા વધારવી હોય તો તેની સૂક્ષ્મ ફૂતિ (અલ્પાકૃતિ) નો વિચાર કરવો પડશે.” તે વૈજ્ઞાનિકનું નામ નીચેનામાંથી કયું છે ?

રફ કાર્ય


- (A) પ્રો. રિચાર્ડ પી. ફેઈનમેન
(B) ડ. એરિક ડ્રેક્સલર
(C) જેભસહીથ
(D) શેન ઓ બ્રાયે

2) ત્રિ પરિમાળીય (3D), મુદ્રણ (Printing), હોલોગ્રાફિક સંગ્રહક, પ્રકાશિય કોમ્પ્યુટરીંગ (ગણક), કવોન્ટમ કીપ્ટોગ્રાફી, સ્પિન્ન્ટોનિક્સ વગેરે શાબ્દો નીચેનામાંથી ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

- (A) બાયો ટેકનોલોજી
- (B) ઇન્જેનિરિંગ ટેકનોલોજી
- (C) રોબોટિક્સ
- (D) પદાર્થ વિજ્ઞાન


(A - ૧૧૩૭)

3) “પ્રકાશનું ગ્રાસું કિરણ પાતળા માધ્યમમાંથી ઘણું માધ્યમમાં જાય છે ત્યારે લંબ તરફ વળે છે અને ઘણું માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, ત્યારે લંબથી દૂર જાય છે, જેને પ્રકાશનું વકીભવન કહે છે.” નીચેની પંચકોણીય ઘન-આકૃતિઓમાંથી ફર્દ આકૃતિ પ્રકાશનું સાચું વકીભવન બતાવે છે ?



આકૃતિ - a

આકૃતિ - b



આકૃતિ - c

આકૃતિ - d

(A) આકૃતિ - a

(B) આકૃતિ - b

(C) આકૃતિ - c

(D) આકૃતિ - d

4) લેન્સની કેન્દ્રલંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર (p) કહે છે, લેન્સનો પાવર ડાયોપ્ટર એકમમાં માપવામાં આવે છે. જ્યશ્રીની આંખના નેત્રમણિ (લેન્સ) ની કેન્દ્રલંબાઈ 25 cm છે. તો જ્યશ્રીની આંખના નેત્રમણિનો પાવર કેટલો હશે ? જ્યશ્રીને કયા લેન્સના ચશ્મા પહેરવા જોઈએ ?

૨૬ કાર્ય

(A) + 4.0 D, બહિગોળ લેન્સ

(B) - 4.0 D, અંતગોળ લેન્સ

(C) + 4.0 D, અંતગોળ લેન્સ

(D) - 4.0 D, બહિગોળ લેન્સ

5) કલરકામ માટે વપરાતા રંગીન પદાર્થોને વર્ણકો કહેવામાં આવે છે. વિવિધ વર્ણકો ઉત્પન્ન કરવા માટે વર્ણકોનું વિયોગિક (substrictive) પદ્ધતિથી મિશ્રણ કરવામાં આવે છે. નીચેનામાંથી કયા રંગનું શોષણ પીળા અને વાદળી વર્ણકો વડે થતું નથી ?

(A) લીલા

(B) નારંગી

(C) પીળો

(D) જંબલી

6) વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે હિવસ કેટલી મિનિટ લાંબો બને છે ?

(A) 0 મિનિટ

(B) 2 મિનિટ

(C) 4 મિનિટ

(D) 8.5 મિનિટ

7) સદેશાવ્યવહારમાં વપરાતા ઓપ્ટિકલ ફાઈબર કયા ચોક્કસ સિધ્યાંત પર કાર્ય કરે છે ?

(A) પૂર્ણ આંતરિક પરાવર્તન

(B) પરાવર્તન

(C) વકીભવન

(D) વિભાજન

૨૬ કાર્ય

8) કાચના સળિયાને રેશમ સાથે ધસીને અને પ્લાસ્ટીકના સળિયાને ફર સાથે ધસીને આ બે સળિયાઓને એકભીજાની નજીક લાવતાં તેમની વચ્ચે આકર્ષણ ઉપજે છે. ધર્ષણ દરમિયાન કાચના સળિયા અને પ્લાસ્ટીકના સળીયા પર કૃયા વિદ્યુતભારો ધારણ થશે ?

- (A) કાચના સળિયા પર ધન વિદ્યુતભાર અને પ્લાસ્ટીકના સળીયા પર ઋણ વિદ્યુતભાર
- (B) કાચના સળિયા પર ઋણ વિદ્યુતભાર અને પ્લાસ્ટીકના સળીયા પર ધન વિદ્યુતભાર
- (C) કાચના સળિયા પર ધન વિદ્યુતભાર અને પ્લાસ્ટીકના સળીયા પર ધન વિદ્યુતભાર
- (D) કાચના સળીયા પર ઋણ વિદ્યુતભાર અને પ્લાસ્ટીકના સળીયા પર ઋણ વિદ્યુતભાર

9) નીચેનામાંથી ક્યા સમીકરણને જૂલનો નિયમ કહે છે ?


- (A) $H = I^2 R t$
- (B) $P = I^2 R$
- (C) $I = \frac{ne}{t}$
- (D) $R = V/I$

10) એક પરિપथમાં વાહુક તારનો અવરોધ 10Ω (ohm) છે. તેને 2.5 volt ની બેટરી જોડતાં તેમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ વહેશે ?


- (A) 0.25 mA
- (B) 2.5 mA
- (C) 25 mA
- (D) 250 mA

- 11) નીચેની આકૃતિઓમાં $I \rightarrow V$ નો આલેખ દોરેલ બતાવેલ છે. ઓહમના નિયમ પ્રમાણે કઈ આકૃતિનો આલેખ સાચો છે ?


(I = વિદ્યુતપ્રવાહ, V = વિદ્યુત સ્થિતિમાન)




આકૃતિ - a



આકૃતિ - b



આકૃતિ - c




આકૃતિ - d

- (A) આકૃતિ - a
 (B) આકૃતિ - b
 (C) આકૃતિ - c
 (D) આકૃતિ - d
- 12) ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ જમણા હાથના પંજની મધ્યમા આંગળી શું દર્શાવે છે ?


- (A) ચુંબકીય ક્ષેત્ર
 (B) વાહકની ગતિ
 (C) વાહકમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહ
 (D) ચુંબકીય બળ

૨૬ કાર્ય


13) નીચે દર્શાવેલ ચાર વર્તુળાકાર રિંગમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરતાં, કઈ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે ?




આકृતિ - a



આકृતિ - b



આકृતિ - c



આકृતિ - d


(A) આકृતિ - a

(B) આકृતિ - b

(C) આકृતિ - c

(D) આકृતિ - d

14) નીચેના વિદ્યુતપરિપथમાં નંબર 1, 2 અને 3 અનુક્રમે શું દર્શાવે છે ?



(A) કળ, બલ્બ, બેટરી

(B) બલ્બ, કળ, બેટરી

(C) કળ, બેટરી, બલ્બ

(D) બેટરી, કળ, બલ્બ

15) ભૌગોલિક નકશા સંબંધી જાણકારી મેળવવા કયો કૃતિમ ઉપગ્રહ ઉપયોગી છે ?

(A) EDUSAT

(B) INSAT-4A

(C) CARTOSAT

(D) METSAT

૨૬ કાર્ય

16) LHC નું પુરું નામ જણાવો.

- (A) લાર્જ હેડ્રોન કોલાઈડર (B) લાઈટ હાઇડ્રોજન કુલર
 (C) લેડ હેડ્રોન કંટ્રોલર (D) લાઈટ હાઇડ્રોજન કોલાઈડર

17) પૃથ્વીને સૂર્યનું પરિક્રમણ કરવામાં 1 વર્ષ લાગે છે, જ્યારે ખુટોને લગભગ પૃથ્વીના 248 વર્ષ લાગે છે; આ માટેનું મુખ્ય કારણ શું છે ?

- (A) ખુટો પૃથ્વી કરતાં કદમાં નાનો હોવાથી પૃથ્વી કરતાં ધીમો ફરે છે.
 (B) ખુટોનું વજન વધુ હોવાથી પૃથ્વી કરતાં ધીમો ફરે છે.
 (C) પૃથ્વી પરના વેગિલા પવનો તેની ફરવાની ઝડપ વધારે છે .
 (D) ખુટો સૂર્યથી ઘણો વધુ દૂર હોવાથી તેને પૃથ્વી કરતાં વધુ અંતર કાપવું પડે છે.

18) સૂર્યની ફરતે 400 km સુધીના તેજસ્વી આવરણને શું કહે છે ?

- (A) કોમોસ્ફિયર (B) સૂર્યકલંકો
 (C) કોરોના (D) શેટોસ્ફિયર

19) pH પેપરને દ્રાવણમાં બોળતા pH પેપરના રંગમાં થતા ફેરફર પ્રમાણે pH મૂલ્યો નીચેના 'અ' અને 'બ' વિભાગમાં ફરજિયાલ છે. તે પરથી તેનો ચોક્કસ જવાબ આપો.

'અ' વિભાગ

'બ' વિભાગ

- | | |
|---------------------|-------|
| 1) ગુલાબી | a) 7 |
| 2) મેંદી (આછો લીલો) | b) 2 |
| 3) લીલો | c) 10 |
| 4) વાદળી | d) 8 |
- (A) $1 \leftrightarrow b$, $2 \leftrightarrow a$, $3 \leftrightarrow d$, $4 \leftrightarrow c$
 (B) $1 \leftrightarrow a$, $2 \leftrightarrow b$, $3 \leftrightarrow c$, $4 \leftrightarrow d$
 (C) $1 \leftrightarrow b$, $2 \leftrightarrow c$, $3 \leftrightarrow d$, $4 \leftrightarrow a$
 (D) $1 \leftrightarrow c$, $2 \leftrightarrow d$, $3 \leftrightarrow a$, $4 \leftrightarrow b$

૨૬ કાર્ય

20) નીચેનામાંથી સોડીધમ જિકેટનું અણુસૂત્ર ક્યું છે ?

- (A) $\text{NaZn}(\text{OH})_3$ (B) $\text{Na}_2\text{Zn}(\text{OH})_4$
 (C) NaZnOH (D) $\text{NaZn}(\text{OH})_4$

21) 4 pH વાળા જલીય દ્રાવણ કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ કેટલા ગણું વધું એસિડિક હશે ?

- (A) 10^2 (B) $1/2$
 (C) 2 (D) 10^{-2}

22) નીચેનામાંથી શા માં ટાઈરિક એસિડ હોય છે ?

- (A) લીંબુમાં (B) વિનેગારમાં
 (C) નારંગીમાં (D) આમલીમાં

23) વૈજ્ઞાનિક તુલા તથા વજનમાં હલકા સાધનો બનાવવામાં ક્યા ઘટકો વપરાય છે ?

- (A) કોપર, જિક
 (B) એલ્યુમિનિયમ, મેન્ઝેરિયમ
 (C) કોપર, ટિન
 (D) નિકલ, કોમિયમ, મેંગેનીઝ, લોઝંડ

24) વિધુતરાસાયણિક રિડક્ષન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમના નિષ્ઠર્ષણમાં ગલનબિંદુ વધું નીચું લાવવા માટે ક્યો પદાર્થ વપરાય છે ?

- (A) નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ
 (B) ફેલ્સપાર
 (C) સ્લેગ
 (D) કાયોલાઈટ

25) કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે ?

૨૬ કાર્ય

- (A) પ્રવાહિકરણ
- (B) કેલ્લિનેશન
- (C) રિફ્લેક્શન
- (D) ભૂંઘન

26) સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે આધુનિક પદ્ધતિ સંપર્ક વિધિનો ઉપયોગ થાય છે, આ સિવાય અન્ય કઈ પદ્ધતિથી તેનું ઉત્પાદન કરી શકાય છે ?

- (A) ઓસ્વાલ પદ્ધતિ
- (B) લેડ ચેમ્બર પદ્ધતિ
- (C) હેબર પદ્ધતિ
- (D) ફાશ પદ્ધતિ

27) કયો વાયુ ફળોના રસ, જામ અને ફળોની સૂક્ષ્વવણીમાં પરિરક્ષક (preservative) તરીકી વપરાય છે ?

- (A) SO_2
- (B) NH_3
- (C) CO_2
- (D) H_2

28) સલ્ફર ડાયોક્સાઇડ (SO_2) માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ (SO_3) ની બનાવટમાં ઉદ્દીપક તરીકી શું વપરાય છે ?

- (A) V_2O_5
- (B) P_2O_5
- (C) Pt
- (D) Ni

- 29) નીચેનામાંથી એન્ટ્રેસાઈટ માટે ક્યું વિધાન ખોદું છે ? ૨૬ કાર્ય
- (A) તેમાં લગભગ 94 - 98 % કાર્બન હોય છે.
 - (B) તેમાં થોડા પ્રમાણમાં બાજુશીલ દ્રવ્ય અને લેજ હોય છે.
 - (C) તેની ઉષ્મા ઊર્જા આશરે 33 કિલો જૂલ ગ્રામ⁻¹ છે.
 - (D) શુદ્ધ એન્ટ્રેસાઈટ બળે ત્યારે અવશેષનું પ્રમાણ ખૂબ જ વધુ રહે છે.
- 30) આલ્કાઈન શ્રેણીનું સામાન્ય સૂત્ર નીચેનામાંથી ક્યું છે ? ૧૮
- (A) $C_n H_{2n}$
 - (B) $C_n H_{2n-2}$
 - (C) $C_n H_{2n-6}$
 - (D) $C_n H_{2n+2}$
- 31) ઈથીન વાયુને હવામાં સળગાવતાં મેશવાળી જ્યોત સાથે બળે છે, આ મેશને શું કહે છે ? ૧૫
- (A) કાર્બન બ્લેક
 - (B) કોલસો
 - (C) લેમ્પબ્લેક
 - (D) ભૂરી મેશ
- 32) કેલિયમ કાર્બાઈડની પાણી સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે ? ૧૮
- (A) મિથેન
 - (B) ઈથીન
 - (C) ઈથાઈન
 - (D) હાઇડ્રોજન

33) નોન સ્ટિક રસોઈનાં સાધનો બનાવવા કયા પોલિમરનો નીચેનામાંથી ઉપયોગ થાય છે ?

- (A) પોલિવિનાઈલ ક્લોરાઈડ
- (B) ટેફ્લોન
- (C) નીયોપ્રીન
- (D) પોલિઝ્યુટાઇન

34) ઓપરેશન પછીના ટંકા લેવા માટે સૌ પ્રથમ વપરાયેલો પોલિમર પદાર્થ ક્યો હતો ?

- (A) PHBV
- (B) ડેક્સ્ટ્રાન (Dextran)
- (C) પોલિથીન (Polythene)
- (D) સ્ટાથરીન ઝ્યુટાઇન રખર (SBR)

35) યુરિયા અને ફોર્માલિનાઈડના સંયોગિકરણથી બનતા રેઝીનને શું કહે છે ?

- (A) VF રેઝીન ફોર્મ
- (B) FU રેઝીન ફોર્મ
- (C) UF રેઝીન ફોર્મ
- (D) FV રેઝીન ફોર્મ

36) અમીબા એકકોણી પ્રાણી છે, અમીબામાં ખોરાક ભેળવવાની પદ્ધતિને કોણીય ઘન ભક્ષણ કહે છે. નીચેનામાંથી પોષણનો ક્યો કમ અમીબામાં સાચો છે ?

- (A) ખોરાક ગ્રહણ \rightarrow પરિપાચન \rightarrow પાચન \rightarrow શોષણ
- (B) ખોરાક ગ્રહણ \rightarrow પાચન \rightarrow શોષણ \rightarrow પરિપાચન
- (C) ખોરાક ગ્રહણ \rightarrow શોષણ \rightarrow પાચન \rightarrow પરિપાચન
- (D) ખોરાક ગ્રહણ \rightarrow પાચન \rightarrow પરિપાચન \rightarrow શોષણ

37) કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોથળીમાં ઝદિર ગળાય છે ?

૨૬ કાર્ય

- (A) પુનઃશોષણ
- (B) સત્ત્રાવ
- (C) અતિસૂક્ષ્મ ગાળણ
- (D) એકપણ નહીં.

38) મનુષ્યના શરીરમાં ઝદિરના વહનના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન અસત્ય છે ?

- (A) જમણા કાર્બોક્સિકમાંથી O_2 મુક્ત ઝદિર જમણા ક્ષેપકમાં ઠલવાય છે.
- (B) વિભિન્ન અંગોમાંથી O_2 વિહિન ઝદિર જમણા ક્ષેપકમાં આવે છે.
- (C) ફેફસામાં ઝદિરમાંથી CO_2 મુક્ત થાય છે.
- (D) જમણા ક્ષેપકના સંકોચનને કારણે ઘમનીઓ દ્વારા ઝદિર ફેફસામાં આવે છે.

39) કેવા પદાર્થોનું સ્થાનાંતર અન્નવાહક પેશીમાં થાયે ત્યારે પેશીમાં આસૂત્રિદાખ વધે છે ?

- (A) જ્લુકોઝ
- (B) કુક્ટ્રોઝ
- (C) સુક્ટ્રોઝ
- (D) ગેલેક્ટ્રોઝ

40) રેઝિન અને ગુંદર વનસ્પતિનાં કેવાં દ્રવ્યો છે ?

- (A) પોષક
- (B) વૃદ્ધિ પ્રેરક
- (C) બંધારણીય
- (D) ઉત્સર્ગ

- ૨૬ કાર્ય**
- 41) ઉધરસ અને છીક જેવી કિયાઓનું નિયમન નીચેનામાંથી ક્યા અંગ દ્વારા થાય છે ?
- (A) અનુમસ્તિજ્ઞ
 (B) મધ્યકપાતી ખંડ
 (C) લંબમજજા
 (D) અગ્રકપાતી ખંડ
- 42) બાળપણમાં વધારે પડતા ક્યા અંતઃસ્ત્રાવના સ્ત્રાવને કારણે વ્યક્તિની ઊંચાઈ ૭ ફૂટ કરતા વધારે થાય છે ?
- (A) TSH
 (B) FSH
 (C) GH
 (D) LH
- 43) વનસ્પતિના પ્રકાંડનો કાપેલો ભાગ (જેના મૂળ જમીનમાં દટાયેલા છે.) કે જેનો ઉપયોગ આરોપણ કરવામાં થાય છે ?
- (A) સ્ટોક
 (B) સાયોન
 (C) કલમ કરવી
 (D) કલિકા
- 44) ક્યા રોગમાં મૂત્રજ્ઞનન માર્ગના શ્લેષ્મસ્તરમાં ઈજા અને સામાન્ય ચાંદી (ulcer) નું લક્ષણ જેવા મળે છે ?
- (A) ગોનોરીયા
 (B) એઈડ્સ
 (C) સિફ્લિસ
 (D) જનનાંગ હર્પિસ

- 25 કાર્ય**
- 45) લીલા પાંડાના ઝાંખરામાં વસવાટ કરતી લાલ રંગના ભમરાની વસતિમાં પ્રજનન દરમિયાન સંતતિમાં કેટલાક ભમરામાં લીલો રંગ ઉદ્ભવે છે. તે માટે નીચેનામાંથી કયું કારણ ચોક્કસ પણે જવાબદાર છે ?
- (A) ભમરાનો લીલો રંગ એ ઉપાર્જિત લાક્ષણિકતા સાથે સંકળાયેલ છે.
 - (B) ભમરાનો લીલો રંગ એ જનીન સ્તરે ફેરફાર સાથે સંકળાયેલ છે.
 - (C) ભમરાનો લીલો રંગ એ લીલા પાંડાના વસવાટ સાથે સંકળાયેલ છે.
 - (D) ઉપરોક્ત ત્રણેથ પૈકી એકપણ નહીં.
- 46) નીચેનામાંથી જંગલી કોબીજની જાતિઓ માટે ઉત્કાંતિનો કયો ક્રમ સાચો છે ?
- (A) કોબી → બ્રોકોલી → ફ્લાવર → કલરબી → કેલે
 - (B) કોબી → ફ્લાવર → બ્રોકોલી → કલરબી → કેલે
 - (C) કોબી → બ્રોકોલી → કલરબી → ફ્લાવર → કેલે
 - (D) કોબી → કલરબી → ફ્લાવર → બ્રોકોલી → કેલે
- 47) સ્ટ્રોસ્ફિયરમાં રહેલાં ઓડોનના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું ગણાય છે ?
- (A) કલોરાઈડ આયન
 - (B) કલોરો ફ્લોરો કાર્બન
 - (C) સલ્ફર આયન
 - (D) મેનેશિયમ આયન
- 48) નિવસનતંત્ર કઈ આંતરક્લિયા તંત્રનું બનેલું છે ?
- (A) સજ્જવો અને તેમનું ભૌતિક પરિસર
 - (B) ઉત્પાદકો અને ઉપભોગીઓ
 - (C) ઉત્પાદકો અને તેમનું ભૌતિક પરિસર
 - (D) ઉપભોગીઓ અને તેમનું ભૌતિક પરિસર

૨૬ કાર્ય

49) “પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ (LPG) ના બદલે ખોરાક રંધવા માટે સૂર્યશક્તિથી ચાલતા વાસણો-સાધનોનો ઉપયોગ કરી શકાય”; તે નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

(A) ઓછું કરવું (Reduce)

(B) પુનઃઉપયોગિતા (Reuse)

(C) પુનઃ ચક્કિયતા (Recycle)

(D) આપેલ પૈકી એકપણ નહીં.

50) ક્યા વૃક્ષોના રક્ષણ માટે અમૃતાદેવી બીજ્નોઈએ તેમના જીવનનું ભલિદાન આપ્યું હતું?

(A) વડ

(B) પીપળો

(C) ખેજરી

(D) લીભડો

[૧]

[૫]

[૩]

11(G)

(MARCH, 2019)

(Part - B)

Time : 2 Hours]

[Maximum Marks : 50]

સૂચનાઓ :

- 1) સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન જળવવું.
- 2) આ પ્રક્રિયાના ભાગ-B માં ચાર વિભાગ છે અને કુલ 1 થી 18 પ્રક્રો આપેલા છે.
- 3) બધા જ પ્રક્રો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે.
- 4) પ્રક્રિયા જમણી બાજુના અંક તેના ગુણ દર્શાવે છે.
- 5) સૂચના પ્રમાણે આકૃતિઓ સ્વચ્છ, સ્પષ્ટ અને પ્રમાણસર દોરવી.
- 6) નવો વિભાગ નવા પાના પર લખવો. પ્રક્રોના જવાબ કુમાં લખવા.

વિભાગ - A

■ નીચે આપેલા 1 થી 5 સુધીના ટૂકા પ્રક્રોના જવાબ વધુમાં વધુ 30 શાબ્દોની મર્યાદામાં લખો. દરેકના 2 ગુણ છે.

- 1) નેનો ટેકનોલોજીને આધુનિક વિજ્ઞાનની દેન માનવામાં આવે પણ તેની ઓળખ તો લાંબા ભૂતકાળથી છે; તે સમજવતા ઈતિહાસના ચાર ઉદાહરણો આપો. [2]

અથવા

સંરક્ષણ ક્ષેત્રે કેવી રીતે નેનો ટેકનોલોજી ઉપયોગી છે તે સમજવો ?

- 2) ઇલેક્ટ્રોપ્લેટીંગ વખતે ધાતુ કેટલા પ્રમાણમાં ધૂલ પર જમા થશો તે માટેના નિયમો લખો. [2]

અથવા

- 3) બહુલીકરણ (પોલિમરાઇઝેશન) એટલે શું ? સમીકરણ આપી સમજવો. [2]

મિથેન વાયુના કોઈપણ ચાર ગુણધર્મો જગ્યાવો.

- 4) લસિકા એટલે શું ? લસિકાતંત્રનાં મહત્વનાં કાર્યો લખો. [2]
- 5) આહાર શૃંખલાના પ્રકારો જણાવો અને સમજાવો. [2]

વિભાગ - B

- નીચે આપેલા 6 થી 10 સુધીના ટૂંકા પ્રશ્નોના જવાબ વધુમાં વધુ 30 શબ્દોની મર્યાદામાં લખો. દરેકના 2 ગુણ છે.

- 6) જોવિયન ગ્રહોની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. [2]

- 7) 0.007 M NaOH ના જલીય દ્રાવણની pOH રોધો. ($\log 7 = 0.8451$ લો.) [2]

- 8) ડાયાબીટીસ રોગના નિયંત્રણ માટેના ચાર ઉપાયો લખો. [2]

- 9) કાર્યસદશ અંગો એટલે શું ? અને કાર્યસદશ અંગો કઈ રીતે ઉત્કાંતિના પુરાવા આપે છે ? સમજાવો. [2]

અથવા

પીંઢાની ઉત્કાંતિ સમજાવો.

- 10) બંધો (ડેમ) સમાજને કઈ રીતે ઉપયોગી છે ? [2]

વિભાગ - C

- નીચે આપેલા 11 થી 15 સુધીના ટૂંકા પ્રશ્નોના જવાબ વધુમાં વધુ 50 શબ્દોની મર્યાદામાં લખો. દરેકના 3 ગુણ છે.

- 11) “તારાઓના ટમટમતા હોવું” પર નોંધ લખો. [3]

- 12) વિદ્યુત મોટર (Electric motor) ની આકૃતિ દોરી કાર્યપદ્ધતિ સમજાવો. [3]

અથવા

સોલેનોઇઝ એટલે શું ? સોલેનોઇઝથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો.

[13] ડાય હાઇડ્રોજન વાયુના ઔદ્યોગિક ઉત્પાદનના સમીકરણ આપો અને બે ઉપયોગો લખો.

[14] ઇથેનોઈક એસિડની બનાવટ સમીકરણ સાથે વર્ણવો, તેમજ ઇથેનોઈક એસિડના બે ઉપયોગો લખો.

અથવા

સાબુ અને ડિટર્જનની પ્રક્ષાળન વિધિ સમજાવો.

[15] સ્ત્રીના પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરી પ્રજનનતંત્રના ગમે તે બે અંગો સમજાવો. [3]

વિભાગ - D

■ નીચે આપેલા 16 થી 18 સુધીના પ્રક્રોના મુદ્દાસર સાચિત્પદ જવાબ વધુમાં વધુ 100 શબ્દોની મર્યાદામાં લખો. દરેકના 5 ગુણ છે.

[16] પ્રાથીય સ્થાનાંતર (લેટરલ શિફ્ટ) કોને કહે છે ? કાચના લંબઘન વડે પ્રકારાનું વકીભવન જરૂરી આકૃતિ દોરીને સમજાવો. [5]

[17] ધ્યાનના વિશુદ્ધીકરણ માટેની પ્રવાહીકરણ અને વિભાગીય વિશુદ્ધીકરણ પદ્ધતિ સમજાવો. (આકૃતિ જરૂરી) [5]

અથવા

વિધુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની હોલ-હેરાઉલ્ટ પદ્ધતિનું વર્ણન આકૃતિ દોરી સમજાવો.

[18] મનુષ્યના પાચનતંત્રમાં છૂટા પડતા કોઈપણ પાંચ પાચક ઉત્સેચકોના નામ અને સ્થાન જણાવી તેમના કાર્યો સમજાવો. [5]

અથવા

પોષણ એટલે શું ? પોષણના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.

